

## ૧ યોહન: પત્રં

I આદિતો ય આસીદ્ યસ્ય વાગ્ અસ્માભિરશ્રાવિ યન્ન વયં સ્વનેત્રૈ દૃષ્ટવન્તો યન્ન વીક્ષિતવન્તઃ સ્વકરૈઃ સ્પૃષ્ટવન્તશ્ચ તં જીવનવાદં વયં જ્ઞાપયામઃ।

II સ જીવનસ્વરૂપઃ પ્રકાશત વયન્ન તં દૃષ્ટવન્તસ્તમધિ સાક્ષ્યં દક્ષશ્ચ, યશ્ચ પિતુઃ સન્નિધાવવર્તતાસ્માકં સમીપે પ્રકાશત ય તમ્ અનન્તજીવનસ્વરૂપં વયં યુષ્માન્ જ્ઞાપયામઃ।

III અસ્માભિ ર્યદ્ દૃષ્ટં શ્રુતન્ન તદેવ યુષ્માન્ જ્ઞાપ્યતે તેનાસ્માભિઃ સહાંશિત્વં યુષ્માકં ભવિષ્યતિ અસ્માકન્ન સહાંશિત્વં પિત્રા તત્પુત્રેણ યીશુપ્રીષ્ટેન ય સાદ્ધ્ ભવતિ।

IV અપરન્ન યુષ્માકમ્ આનન્દો યત્ સમ્પૂર્ણો ભવેદ્ તદર્થં વયમ્ એતાનિ લિખામઃ।

V વયં યાં વાર્તાં તસ્માત્ શ્રુત્વા યુષ્માન્ જ્ઞાપયામઃ સેયમ્ ઈશ્વરો જ્યોતિસ્તસ્મિન્ અન્ધકારસ્ય લેશોઽપિ નાસ્તિ।

VI વયં તેન સહાંશિન ઇતિ ગદિત્વા યદન્ધાકારે યરામસ્તર્હિ સત્યાચારિણો ન સન્તો ડનૃતવાદિનો ભવામઃ।

VII કિન્તુ સ યથા જ્યોતિષિ વર્તતે તથા વયમપિ યદિ જ્યોતિષિ યરામસ્તર્હિ પરસ્પરં સહભાગિનો ભવામસ્તસ્ય પુત્રસ્ય યીશુપ્રીષ્ટસ્ય રુધિરન્નાસ્માન્ સર્વ્વસ્માત્ પાપાત્ શુદ્ધયતિ।

VIII વયં નિષ્પાપા ઇતિ યદિ વદામસ્તર્હિ સ્વયમેવ સ્વાન્ વન્નયામઃ સત્યમતન્નાસ્માકમ્ અન્તરે ન વિદ્યતે।

IX યદિ સ્વપાપાનિ સ્વીકુર્મહે તર્હિ સ વિશ્વાસ્યો યાથાર્થિકશ્ચાસ્તિ તસ્માદ્ અસ્માકં પાપાનિ ક્ષમિષ્યતે સર્વ્વસ્માદ્ અધર્માચ્યાસ્માન્ શુદ્ધયિષ્યતિ।

X વયમ્ અકૃતપાપા ઇતિ યદિ વદામસ્તર્હિ તમ્ અનૃતવાદિનં કુર્મસ્તસ્ય વાક્યન્નાસ્માકમ્ અન્તરે ન વિદ્યતે।

## II

I હે પ્રિયબાલકાઃ, યુષ્માભિ ર્યત્ પાપં ન ક્રિયેત તદર્થં યુષ્માન્ પ્રત્યેતાનિ મયા લિખ્યન્તો યદિ તુ કેનાપિ પાપં ક્રિયતે તર્હિં પિતુઃ સમીપે ડસ્માકં એકઃ સહાયો ડર્થતો ધાર્મિકો યીશુઃ ખ્રીષ્ટો વિદ્યતે।

II સ યાસ્માકં પાપાનાં પ્રાયશ્ચિત્તં કેવલમસ્માકં નહિ કિન્તુ લિખિલસંસારસ્ય પાપાનાં પ્રાયશ્ચિત્તં।

III વયં તં જ્ઞાનીમ ઇતિ તદીયાજ્ઞાપાલનેનાવગચ્છામઃ।

IV અહં તં જ્ઞાનામીતિ વદિત્વા યસ્તસ્યાજ્ઞા ન પાલયતિ સો ડનૃતવાદી સત્યમતઞ્ચ તસ્યાન્તરે ન વિદ્યતે।

V યઃ કશ્ચિત્ તસ્ય વાક્યં પાલયતિ તસ્મિન્ ઈશ્વરસ્ય પ્રેમ સત્યરૂપેણ સિદ્ધયતિ વયં તસ્મિન્ વર્ત્તામહે તદ્ એતેનાવગચ્છામઃ।

VI અહં તસ્મિન્ તિષ્ઠામીતિ યો ગદતિ તસ્યેદમ્ ઉચિતં યત્ ખ્રીષ્ટો યાદૃગ્ આચરિતવાન્ સો ડપિ તાદૃગ્ આચરેત્।

VII હે પ્રિયતમાઃ, યુષ્માન્ પ્રત્યહં નૂતનામાજ્ઞાં લિખામીતિ નહિ કિન્ત્વાદિતો યુષ્માભિ લ્બધ્વાં પુરાતનામાજ્ઞાં લિખામિ આદિતો યુષ્માભિ ર્યદ્ વાક્યં શ્રુતં સા પુરાતનાજ્ઞા।

VIII પુનરપિ યુષ્માન્ પ્રતિ નૂતનાજ્ઞા મયા લિખ્યત એતદપિ તસ્મિન્ યુષ્માસુ ય સત્યં, યતો ડન્ધકારો વ્યત્યેતિ સત્યા જ્યોતિશ્ચેદાની પ્રકાશતેઃ

IX અહં જ્યોતિષિ વર્ત્ત ઇતિ ગદિત્વા યઃ સ્વભ્રાતરં દ્વેષ્ટિ સો ડદ્યાપિ તમિશ્ચે વર્ત્તતે।

X સ્વભ્રાતરિ યઃ પ્રીયતે સ એવ જ્યોતિષિ વર્ત્તતે વિઘ્નજનકં કિમપિ તસ્મિન્ ન વિદ્યેતે।

XI કિન્તુ સ્વભ્રાતરં યો દ્વેષ્ટિ સ તિમિરે વર્ત્તતે તિમિરે ચરતિ ય તિમિરેણ ય તસ્ય નયને ડન્ધીક્રિયેતે તસ્માત્ ક્ક યામીતિ સ જ્ઞાતું ન શક્નોતિ।

XII હે શિશવઃ, યૂયં તસ્ય નામ્ના પાપક્ષમાં પ્રાપ્તવન્તસ્તસ્માદ્ અહં યુષ્માન્ પ્રતિ લિખામિ।

XIII હે પિતરઃ, ય આદિતો વર્ત્તમાનસ્તં યૂયં જ્ઞાનીથ તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખામિ હે યુવાનઃ યૂયં પાપત્માનં જિતવન્તસ્તસ્માદ્ યુષ્માન્

प्रति लिप्तामि डे बालकाः, यूयं पितरं जानीथ तस्माद् अहं युष्मान् प्रति लिपितवान्।

XIV डे पितरः, आदितो यो वर्तमानस्तं यूयं जानीथ तस्माद् युष्मान् प्रति लिपितवान्। डे युवानः, यूयं बलवन्त आध्वे, ईश्वरस्य वाक्यञ्च युष्मदन्तरे वर्तते पापात्मा य युष्माभिः पराजिग्ये तस्माद् युष्मान् प्रति लिपितवान्।

XV यूयं संसारे संसारस्थविषयेषु य मा प्रीयध्वं यः संसारे प्रीयते तस्यान्तरे पितुः प्रेम न तिष्ठति।

XVI यतः संसारे यद्यत् स्थितम् अर्थतः शारीरिकभावस्याभिलाषो दर्शनेन्द्रियस्याभिलाषो श्रुवनस्य गर्वश्च सर्वमेतत् पितृतो न जायते किन्तु संसारदेवा।

XVII संसारस्तदीयाभिलाषश्च व्यत्येति किन्तु य ईश्वरस्येष्टं करोति सो ऽनन्तकालं यावत् तिष्ठति।

XVIII डे बालकाः, शेषकालोऽयं, अपरं प्रीष्टारिणोपस्थाव्यमिति युष्माभि र्यथा श्रुतं तथा बडवः प्रीष्टारय उपस्थितास्तस्माद्यं शेषकालोऽस्तीति वयं जानीमः।

XIX ते ऽस्मन्मध्यान् निर्गतवन्तः किन्त्वस्मदीया नासन् यद्यस्मदीया अभविष्यन् तर्ह्यस्मत्सङ्गे ऽस्थास्यन्, किन्तु सर्वे ऽस्मदीया न सन्त्येतस्य प्रकाश आवश्यक आसीत्।

XX यः पवित्रस्तस्माद् यूयम् अभिषेकं प्राप्तवन्तस्तेन सर्वाणि जानीथा।

XXI यूयं सत्यमतं न जानीथ तत्कारणाद् अहं युष्मान् प्रति लिपितवान् तन्नहि किन्तु यूयं तत् जानीथ सत्यमताय्य किमप्यनृतवाक्यं नोत्पद्यते तत्कारणादेवा।

XXII यीशुरभिषिक्तस्त्रातेति यो नाङ्गीकरोति तं विना को ऽपरो ऽनृतवादी भवेत्? स अेव प्रीष्टारि र्यः पितरं पुत्रञ्च नाङ्गीकरोति।

XXIII यः कश्चित् पुत्रं नाङ्गीकरोति स पितरमपि न धारयति यश्च पुत्रमङ्गीकरोति स पितरमपि धारयति।

XXIV આદિતો યુષ્માભિ ર્યત્ શ્રુતં તદ્ યુષ્માસુ તિષ્ઠતુ, આદિતઃ શ્રુતં વાક્યં યદિ યુષ્માસુ તિષ્ઠતિ, તર્હિ યૂયમપિ પુત્રે પિતરિ ચ સ્થાસ્યથા

XXV સ ચ પ્રતિજ્ઞાયાસ્મભ્યં યત્ પ્રતિજ્ઞાતવાન્ તદ્ અનન્તજીવનં

XXVI યે જના યુષ્માન્ ભ્રામયન્તિ તાનધ્યહમ્ ઇદં લિખિતવાન્

XXVII અપરં યૂયં તસ્માદ્ યમ્ અભિષેકં પ્રાપ્તવન્તઃ સ યુષ્માસુ તિષ્ઠતિ તતઃ કોડપિ યદ્ યુષ્માન્ શિક્ષયેત્ તદ્ અનાવશ્યકં, સ ચાભિષેકો યુષ્માન્ સર્વ્વાણિ શિક્ષયતિ સત્યશ્ચ ભવતિ ન ચાતથ્યઃ, અતઃ સ યુષ્માન્ યદ્દદ્ અશિક્ષયત્ તદ્દત્ તત્ર સ્થાસ્યથા

XXVIII અતએવ હે પ્રિયબાલકા યૂયં તત્ર તિષ્ઠત, તથા સતિ સ યદા પ્રકાશિષ્યતે તદા વયં પ્રતિભાન્વિતા ભવિષ્યામઃ, તસ્યાગમનસમયે ચ તસ્ય સાક્ષાન્ન ત્રપિષ્યામહે

XXIX સ ધાર્મિકો ડસ્તીતિ યદિ યૂયં જાનીથ તર્હિ યઃ કશ્ચિદ્ ધર્માચારં કરોતિ સ તસ્માત્ જાત ઇત્યપિ જાનીતા

### III

I પશ્યત વયમ્ ઈશ્વરસ્ય સન્તાના ઇતિ નામ્નાપ્યામહે, એતેન પિતાસ્મભ્યં કીદૃક્ મહાપ્રેમ પ્રદત્તવાન્, કિન્તુ સંસારસ્તં નાજાનાત્ તત્કારણાદસ્માન્ અપિ ન જાનાતિ

II હે પ્રિયતમાઃ, ઇદાનીં વયમ્ ઈશ્વરસ્ય સન્તાના આસ્મહે પશ્ચાત્ કિં ભવિષ્યામસ્તદ્ અદ્યાપ્યપ્રકાશિતં કિન્તુ પ્રકાશં ગતે વયં તસ્ય સદૃશા ભવિષ્યામિ ઇતિ જાનીમઃ, યતઃ સ યાદૃશો ડસ્તિ તાદૃશો ડસ્માભિર્દર્શિષ્યતે

III તસ્મિન્ એષા પ્રત્યાશા યસ્ય કસ્યચિદ્ ભવતિ સ સ્વં તથા પવિત્રં કરોતિ યથા સ પવિત્રો ડસ્તિ

IV યઃ કશ્ચિત્ પાપમ્ આચરતિ સ વ્યવસ્થાલક્ષ્ણં કરોતિ યતઃ પાપમેવ વ્યવસ્થાલક્ષ્ણં

V અપરં સો ડસ્માકં પાપાન્યપહર્તુ પ્રાકાશતૈતદ્ યૂયં જાનીથ, પાપઞ્ચ તસ્મિન્ ન વિદ્યતે

VI યઃ કશ્ચિત્ તસ્મિન્ તિષ્ઠતિ સ પાપાચારં ન કરોતિ યઃ કશ્ચિત્ પાપાચારં કરોતિ સ તં ન દૃષ્ટવાન્ ન વાવગતવાન્

VII હે પ્રિયબાલકાઃ, કશ્ચિદ્ યુષ્માકં ભ્રમં ન જનયેત્, યઃ કશ્ચિદ્ ધર્માચારં કરોતિ સ તાદૃગ્ ધાર્મિકો ભવતિ યાદૃક્ સ ધાર્મિકો ડસ્તિ।

VIII યઃ પાપાચારં કરોતિ સ શયતાનાત્ જાતો યતઃ શયતાન આદિતઃ પાપાચારી શયતાનસ્ય કર્મણાં લોપાર્થમેવેશ્વરસ્ય પુત્રઃ પ્રાકાશત।

IX યઃ કશ્ચિદ્ ઈશ્વરાત્ જાતઃ સ પાપાચારં ન કરોતિ યતસ્તસ્ય વીર્યં તસ્મિન્ તિષ્ઠતિ પાપાચારં કર્તુઞ્ચ ન શક્નોતિ યતઃ સ ઈશ્વરાત્ જાતઃ।

X ઇત્યનેનેશ્વરસ્ય સન્તાનાઃ શયતાનસ્ય ય સન્તાના વ્યક્તા ભવન્તિ યઃ કશ્ચિદ્ ધર્માચારં ન કરોતિ સ ઈશ્વરાત્ જાતો નહિ યશ્ચ સ્વભ્રાતરિ ન પ્રીયતે સો ડપીશ્વરાત્ જાતો નહિ।

XI યતસ્તસ્ય ય આદેશ આદિતો યુષ્માભિઃ શ્રુતઃ સ એષ એવ યદ્ અસ્માભિઃ પરસ્પરં પ્રેમ કર્તવ્યં।

XII પાપાત્મતો જાતો યઃ કાબિલ્ સ્વભ્રાતરં હતવાન્ તત્સદૃશૈરસ્માભિર્ન ભવિતવ્યં સ કસ્માત્ કારણાત્ તં હતવાન્? તસ્ય કર્મ્માણિ દુષ્ટાનિ તદ્ભ્રાતુશ્ચ કર્મ્માણિ ધર્માણ્યાસન્ ઇતિ કારણાત્।

XIII હે મમ ભ્રાતરઃ, સંસારો યદિ યુષ્માન્ દ્વેષ્ટિ તર્હિ તદ્ આશ્ચર્યં ન મન્યધ્વાં।

XIV વયં મૃત્યુમ્ ઉત્તીર્ય જીવનં પ્રાપ્તવન્તસ્તદ્ ભ્રાતૃષુ પ્રેમકરણાત્ જાનીમઃ। ભ્રાતરિ યો ન પ્રીયતે સ મૃત્યૌ તિષ્ઠતિ।

XV યઃ કશ્ચિત્ સ્વભ્રાતરં દ્વેષ્ટિ સં નરઘાતી કિઞ્ચાનન્તજીવનં નરઘાતિનઃ કસ્યાપ્યન્તરે નાવતિષ્ઠતે તદ્ યૂયં જાનીથા।

XVI અસ્માકં કૃતે સ સ્વપ્રાણાંસ્ત્યક્તવાન્ ઇત્યનેન વયં પ્રેમ્નસ્તત્ત્વમ્ અવગતાઃ, અપરં ભ્રાતૃણાં કૃતે ડસ્માભિરપિ પ્રાણાસ્ત્યક્તવ્યાઃ।

XVII સાંસારિકજીવિકાપ્રાપ્તો યો જનઃ સ્વભ્રાતરં દીનં દૃષ્ટ્વા તસ્માત્ સ્વીયદયાં રુણદ્ધિ તસ્યાન્તર ઈશ્વરસ્ય પ્રેમ કથં તિષ્ઠેત્?

XVIII હે મમ પ્રિયબાલકાઃ, વાક્યેન જિહ્વાયા વાસ્માભિઃ પ્રેમ ન કર્તવ્યં કિન્તુ કાર્યેણ સત્યતયા ચૈવા

XIX એતેન વયં યત્ સત્યમતસમ્બન્ધીયાસ્તત્ જાનીમસ્તસ્ય સાક્ષાત્ સ્વાન્તઃકરણાનિ સાન્ત્વયિતું શક્યામશ્ચા

XX यतो ऽस्मदन्तःकरणं यद्यस्मान् दूषयति तर्ह्यस्मदन्तः करणाद्  
 ईश्वरो मडान् सर्वज्ञश्च।

XXI डे प्रियतमाः, अस्मदन्तःकरणं यद्यस्मान् न दूषयति तर्हि वयम्  
 ईश्वरस्य साक्षात् प्रतिबान्विता भवामः।

XXII यद्य प्रार्थयामडे तत् तस्मात् प्राप्नुमः, यतो वयं तस्याज्ञाः  
 पालयामस्तस्य साक्षात् तुष्टिजनकम् आचारं कुर्मश्च।

XXIII अपरं तस्येयमाज्ञा यद् वयं पुत्रस्य यीशुः प्रीष्टस्य नाम्नि  
 विश्वसिमस्तस्याज्ञानुसारेण य परस्परं प्रेम कुर्मः।

XXIV यश्च तस्याज्ञाः पालयति स तस्मिन् तिष्ठति तस्मिन् सोऽपि  
 तिष्ठति; स यास्मान् यम् आत्मानं दत्तवान् तस्मात् सो ऽस्मासु  
 तिष्ठतीति ज्ञानीमः।

## IV

I डे प्रियतमाः, यूयं सर्वेष्व्वात्मसु न विश्वसित किन्तु ते ईश्वरात् जाता  
 न वेत्यात्मनः परीक्षध्वं यतो बडवो मृषाभविष्यद्वादिनो जगन्मध्यम्  
 आगतवन्तः।

II ईश्वरीयो य आत्मा स युष्माभिस्त्वेन परियीयतां, यीशुः प्रीष्टो  
 नरावतारो भूत्वागत अतद् येन केनचिद् आत्मना स्वीक्रियते स  
 ईश्वरीयः।

III किन्तु यीशुः प्रीष्टो नरावतारो भूत्वागत अतद् येन केनचिद्  
 आत्मना नाङ्गीक्रियते स ईश्वरीयो नहि किन्तु प्रीष्टारेरात्मा, तेन  
 यागन्तव्यमिति युष्माभिः श्रुतं, स येदानीमपि जगति वर्तते।

IV डे बालकाः, यूयम् ईश्वरात् जातास्तान् जितवन्तश्च यतः  
 संसाराधिष्ठानकारिणो ऽपि युष्मदधिष्ठानकारी मडान्।

V ते संसारात् जातास्ततो डेतोः संसाराद् भाषन्ते संसारश्च तेषां  
 वाक्यानि गृह्णाति।

VI वयम् ईश्वरात् जाताः, ईश्वरं यो ज्ञानाति सोऽस्मद्वाक्यानि  
 गृह्णाति यश्चेश्वरात् जातो नहि सोऽस्मद्वाक्यानि न गृह्णाति; अनेन वयं  
 सत्यात्मानं भ्रामकात्मानञ्च परियिनुमः।

VII હે પ્રિયતમાઃ, વયં પરસ્પરં પ્રેમ કરવામ, યતઃ પ્રેમ ઈશ્વરાત્ જાયતે, અપરં યઃ કશ્ચિત્ પ્રેમ કરોતિ સ ઈશ્વરાત્ જાત ઈશ્વરં વેત્તિ ચા

VIII યઃ પ્રેમ ન કરોતિ સ ઈશ્વરં ન જાનાતિ યત ઈશ્વરઃ પ્રેમસ્વરૂપઃ।

IX અસ્માસ્વીશ્વરસ્ય પ્રેમૈતેન પ્રાકાશત યત્ સ્વપુત્રેણાસ્મભ્યં જીવનદાનાર્થમ્ ઈશ્વરઃ સ્વીયમ્ અદ્વિતીયં પુત્રં જગન્મધ્યં પ્રેષિતવાન્।

X વયં યદ્ ઈશ્વરે પ્રીતવન્ત ઇત્યત્ર નહિ કિન્તુ સ યદસ્માસુ પ્રીતવાન્ અસ્મત્પાપાનાં પ્રાયશ્ચિત્તાર્થં સ્વપુત્રં પ્રેષિતવાંશ્ચેત્યત્ર પ્રેમ સન્તિષ્ઠતો

XI હે પ્રિયતમાઃ, અસ્માસુ યદીશ્વરેણૈતાદૃશં પ્રેમ કૃતં તર્હિ પરસ્પરં પ્રેમ કર્તુમ્ અસ્માકમપ્યુચિતાં

XII ઈશ્વરઃ કદાચ કેનાપિ ન દૃષ્ટઃ યદ્ઘસ્માભિઃ પરસ્પરં પ્રેમ ક્રિયતે તર્હીશ્વરો ડસ્મન્મધ્યે તિષ્ઠતિ તસ્ય પ્રેમ યાસ્માસુ સેત્સ્યતો

XIII અસ્મભ્યં તેન સ્વકીયાત્મનોડશો દત્ત ઇત્યનેન વયં યત્ તસ્મિન્ તિષ્ઠામઃ સ ય યદ્ અસ્માસુ તિષ્ઠતીતિ જાનીમઃ।

XIV પિતા જગત્રાતારં પુત્રં પ્રેષિતવાન્ એતદ્ વયં દૃષ્ટ્વા પ્રમાણયામઃ।

XV યીશુરીશ્વરસ્ય પુત્ર એતદ્ યેનાઙ્ગીક્રિયતે તસ્મિન્ ઈશ્વરસ્તિષ્ઠતિ સ યેશ્વરે તિષ્ઠતિ।

XVI અસ્માસ્વીશ્વરસ્ય યત્ પ્રેમ વર્તતે તદ્ વયં જ્ઞાતવન્તસ્તસ્મિન્ વિશ્વાસિતવન્તશ્ચા ઈશ્વરઃ પ્રેમસ્વરૂપઃ પ્રેમ્ની યસ્તિષ્ઠતિ સ ઈશ્વરે તિષ્ઠતિ તસ્મિંશ્ચેશ્વરસ્તિષ્ઠતિ।

XVII સ યાદૃશો ડસ્તિ વયમપ્યેતસ્મિન્ જગતિ તાદૃશા ભવામ એતસ્માદ્ વિચારદિને ડસ્માભિ યા પ્રતિભા લભ્યતે સાસ્મત્સમ્બન્ધીયસ્ય પ્રેમ્નઃ સિદ્ધિઃ।

XVIII પ્રેમ્નિ ભીતિ ન વર્તતે કિન્તુ સિદ્ધં પ્રેમ ભીતિં નિરાકરોતિ યતો ભીતિઃ સયાતનાસ્તિ ભીતો માનવઃ પ્રેમ્નિ સિદ્ધો ન જાતઃ।

XIX અસ્માસુ સ પ્રથમં પ્રીતવાન્ ઇતિ કારણાદ્ વયં તસ્મિન્ પ્રીયામહો

XX ઈશ્વરે ડહં પ્રીય ઇત્યુક્ત્વા યઃ કશ્ચિત્ સ્વભ્રાતરં દ્વેષ્ટિ સો ડનૃતવાદી। સ યં દૃષ્ટવાન્ તસ્મિન્ સ્વભ્રાતરિ યદિ ન પ્રીયતે તર્હિ યમ્ ઈશ્વરં ન દૃષ્ટવાન્ કથં તસ્મિન્ પ્રેમ કર્તુ શક્નુયાત્?

XXI અત ઈશ્વરે યઃ પ્રીયતે સ સ્વીયભ્રાતર્યપિ પ્રીયતામ્ ઇયમ્ આજ્ઞા તસ્માદ્ અસ્માભિ લ્બધ્વા

## V

I યીશુરભિષિક્તસ્ત્રાતેતિ યઃ કશ્ચિદ્ વિશ્વાસિતિ સ ઈશ્વરાત્ જાતઃ; અપરં યઃ કશ્ચિત્ જનયિતરિ પ્રીયતે સ તસ્માત્ જાતે જને ડપિ પ્રીયતે

II વયમ્ ઈશ્વરસ્ય સન્તાનેષુ પ્રીયામહે તદ્ અનેન જાનીમો યદ્ ઈશ્વરે પ્રીયામહે તસ્યાજ્ઞાઃ પાલયામશ્ચ

III યત ઈશ્વરે યત્ પ્રેમ તત્ તદીયાજ્ઞાપાલનેનાસ્માભિઃ પ્રકાશયિતવ્યં, તસ્યાજ્ઞાશ્ચ કઠોરા ન ભવન્તિ

IV યતો યઃ કશ્ચિદ્ ઈશ્વરાત્ જાતઃ સ સંસારં જયતિ કિંચાસ્માકં યો વિશ્વાસઃ સ એવાસ્માકં સંસારજયિજયઃ!

V યીશુરીશ્વરસ્ય પુત્ર ઇતિ યો વિશ્વસિતિ તં વિના કોઽપરઃ સંસારં જયતિ?

VI સોઽભિષિક્તસ્ત્રાતા યીશુસ્તોયરુઘિરાભ્યામ્ આગતઃ કેવલં તોયેન નહિ કિન્તુ તોયરુઘિરાભ્યામ્, આત્મા ચ સાક્ષી ભવતિ યત આત્મા સત્યતાસ્વરૂપઃ!

VII યતો હેતોઃ સ્વર્ગો પિતા વાદઃ પવિત્ર આત્મા ચ ત્રય ઇમે સાક્ષિણઃ સન્તિ, ત્રય ઇમે ચૈકો ભવન્તિ

VIII તથા પૃથિવ્યામ્ આત્મા તોયં રુઘિરશ્ચ ત્રીણ્યેતાનિ સાક્ષ્યં દદાતિ તેષાં ત્રયાણામ્ એકત્વં ભવતિ ચા

IX માનવાનાં સાક્ષ્યં યદ્ અસ્માભિ ગૃહ્યતે તર્હીશ્વરસ્ય સાક્ષ્યં તસ્માદપિ શ્રેષ્ઠં યતઃ સ્વપુત્રમધીશ્વરેણ દત્તં સાક્ષ્યમિદં!

X ઈશ્વરસ્ય પુત્રે યો વિશ્વાસિતિ સ નિજાન્તરે તત્ સાક્ષ્યં ધારયતિ; ઈશ્વરે યો ન વિશ્વસિતિ સ તમ્ અનૃતવાદિનં કરોતિ યત ઈશ્વરઃ સ્વપુત્રમધિ યત્ સાક્ષ્યં દત્તવાન્ તસ્મિન્ સ ન વિશ્વસિતિ!

XI તસ્ય સાક્ષ્યમિદં યદ્ ઈશ્વરો ડસ્મભ્યમ્ અનન્તજીવનં દત્તવાન્ તસ્ય જીવનં તસ્ય પુત્રે વિદ્યતે!

XII યઃ પુત્રં ધારયતિ સ જીવનં ધારિયતિ, ઈશ્વરસ્ય પુત્રં યો ન ધારયતિ સ જીવનં ન ધારયતિ!



XIII ઈશ્વરપુત્રસ્ય નામ્નિ યુષ્માન્ પ્રત્યેતાનિ મયા લિખિતાનિ તસ્યાભિપ્રાયો ડયં યદ્ યૂયમ્ અનન્તજીવનપ્રાપ્તા ઇતિ જાનીયાત તસ્યેશ્વરપુત્રસ્ય નામ્નિ વિશ્વસેત યા

XIV તસ્યાન્તિકે ડસ્માકં યા પ્રતિભા ભવતિ તસ્યાઃ કારણમિદં યદ્ વયં યદિ તસ્યાભિમતં કિમપિ તં યાયામહે તર્હિ સો ડસ્માકં વાક્યં શૃણોતિ।

XV સ યાસ્માકં યત્ કિઞ્ચન યાયનં શૃણોતીતિ યદિ જાનીમસ્તર્હિ તસ્માદ્ યાયિતા વરા અસ્માભિઃ પ્રાપ્યન્તે તદપિ જાનીમઃ।

XVI કશ્ચિદ્ યદિ સ્વભ્રાતરમ્ અમૃત્યુજનકં પાપં કુર્વન્તં પશ્યતિ તર્હિ સ પ્રાર્થનાં કરોતુ તેનેશ્વરસ્તસ્મૈ જીવનં દાસ્યતિ, અર્થતો મૃત્યુજનકં પાપં યેન નાકારિતસ્મૈ કિન્તુ મૃત્યુજનકમ્ એકં પાપમ્ આસ્તે તદદિ તેન પ્રાર્થના ક્રિયતામિત્યહં ન વદામિ।

XVII સર્વ એવાધર્મઃ પાપં કિન્તુ સર્વપાપં મૃત્યુજનકં નહિ।

XVIII ય ઈશ્વરાત્ જાતઃ સ પાપાયારં ન કરોતિ કિન્ત્વીશ્વરાત્ જાતો જનઃ સ્વં રક્ષતિ તસ્માત્ સ પાપાત્મા તં ન સ્પૃશતીતિ વયં જાનીમઃ।

XIX વયમ્ ઈશ્વરાત્ જાતાઃ કિન્તુ કૃત્સ્નઃ સંસારઃ પાપાત્મનો વશં ગતો ડસ્તીતિ જાનીમઃ।

XX અપરમ્ ઈશ્વરસ્ય પુત્ર આગતવાન્ વયઞ્ચ યયા તસ્ય સત્યમયસ્ય જ્ઞાનં પ્રાપ્નુયામસ્તાદૃશીં ધિયમ્ અસ્મભ્યં દત્તવાન્ ઇતિ જાનીમસ્તસ્મિન્ સત્યમયે ડર્થતસ્તસ્ય પુત્રે યીશુષ્ચીષ્ટે તિષ્ઠામશ્ચ; સ એવ સત્યમય ઈશ્વરો ડનન્તજીવનસ્વરૂપશ્ચાસ્તિ।

XXI હે પ્રિયબાલકાઃ, યૂયં દેવમૂર્તિભ્યઃ સ્વાન્ રક્ષતા આમેન્।

## **Sanskrit Bible (NT) in Gujarati Script New Testament in Sanskrit Language; printed in Gujarati Script**

copyright © 2018 SanskritBible.in

Language: Sanskrit

Contributor: SanskritBible.in

Thank you for your interest in Sanskrit Bible.

Sanskrit Bible (NT) is freely available in 22 different scripts of your choice. This edition is in Gujarati script and is based on the Sanskrit translation of the Holy Bible published by Calcutta Baptist Missionaries in 1851. Please visit [SanskritBible.in](http://SanskritBible.in) to learn more about Sanskrit Bible and to download various free Christian literature.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2020-01-01

---

PDF generated using Haiola and XeLaTeX on 4 Mar 2023 from source files dated 29 Jan 2022

e1290797-4477-53f0-873d-c9153a72fd01